

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 15-04-2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Shri Khodiyar Carling, 2. Mr. Paresb Kumar J Pansuriya, 3. Mrs. Vaishaliben Paresbhai Pansuriya, to repay the amount mentioned in the notice being Rs. 1140113.34/- (Rupees Eleven Lakh Forty Thousand One Hundred Thirteen Paise Thirty Four Only) as on 15-Apr-19 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 6<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 1140113.34/- (Rupees Eleven Lakh Forty Thousand One Hundred Thirteen Paise Thirty Four Only) as on 15-Apr-19 and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES**  
Immovable property, Premises of Shop no. 4 admeasuring 246.08 sq. fts., i.e. 22.87 sq. mtrs., built up area alongwith construction, along with proportionate undivided share in Road, COP & Ground Land admeasuring 12.82 sq. mtrs., "BUILDING - C", "GROUND FLOOR", "SAI PUJAN RESIDENCY", developed upon land situated in State: Gujarat, District: Surat, Sub-District & Taluka: Surat/Surat City, Moje: Village Dindoli Revenue Survey No. 330/2, Block No. 475, T. p. Scheme No. 40(LimbayatDindoli), Final Plot No. 57/B (As per T.R. New Final Plot No. 107) admeasuring 5477.00 sq. mtrs. Paikae admeasuring 4062.29 sq. mtrs., For Residential Purposed & admeasuring 1414.31 sq. mtrs. For Commercial Purposed NALand Paikae.

**On The East : Adjoining Shop No. 5., On The West : Adjoining Shop No. 3., On The North : Adjoining Road., On The South : Adjoining Compound.**

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
Place : Surat (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
Loan Account No: 13029820 & 13041506.

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 05.03.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Shree Bhavani Transport, 2. Chimanlal Manglal Sigar, 3. Chhotidevi Chimanlal Sigar, to repay the amount mentioned in the notice being Rs. 17,24,867.02/- (Rupees Seventeen Lakhs Twenty Four Thousand Eight Hundred Sixty Seven and Paise Two Only) as on 05.03.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 6<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 17,24,867.02/- (Rupees Seventeen Lakhs Twenty Four Thousand Eight Hundred Sixty Seven and Paise Two Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES**  
All the piece and parcel of the property consisting of Flat No. A/402, Indraprasth Complex Opp Sonal Residency, Revenue Survey No. 88/1+2, Block No. 62, Magob Parvat Patiya, Surat-394211.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
Place : Surat (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
Loan Account No: 2775088.

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 20.02.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Jatin Jewels, 2. Jatin Jayendrabhai Soni, 3. Samita Jatin Soni, to repay the amount mentioned in the notice being Rs. 14,29,004.14/- (Rupees Fourteen Lakh Twenty Nine Thousand Four and Paise Fourteen Only) as on 20.02.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 06<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 14,29,004.14/- (Rupees Fourteen Lakh Twenty Nine Thousand Four and Paise Fourteen Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF MORTGAGE PROPERTY**  
All the piece and parcel of the property consisting of Flat No. 1101, Arpan Apartment, Arpan Co-Op. Housing Society, Kadarshani Nalinapur, Surat - 395002.

Date : 06-July-2019  
Place : Surat  
Loan Account No: 4559365.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 21.02.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Maan Restaurants And Hospitality Services, 2. Ajay Subhashy Bhagat, 3. Jyoti Ajay Bhagat, 4. Balubhai Khushalbai Ahir, 5. Pravinbhai K Ahir, 6. Hirenkumar Nalinbhai Ahir, to repay the amount mentioned in the notice being Rs. 1,07,63,569.69/- (Rupees One Crore Seven Lakh Sixty Three Thousand Five Hundred Sixty Nine and Paise Sixty Nine Only) as on 21.02.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 06<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 1,07,63,569.69/- (Rupees One Crore Seven Lakh Sixty Three Thousand Five Hundred Sixty Nine and Paise Sixty Nine Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF MORTGAGE PROPERTY**  
All the piece and parcel of the property consisting of Shop No 304, 3rd Floor, Revenue Survey No. 657/3, T.P. Scheme No.10 Riddhi Shoppers, Surat/Hajira Road, Adajan, Surat-395009.

Date : 06-July-2019  
Place : Surat  
Loan Account No: 4188973 & 3658190.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 21.02.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Sarika Textiles, 2. Sarika Alpesh Modi, 3. Alpeshkumar Rameshchandra Modi, to repay the amount mentioned in the notice being Rs. 53,34,067.87/- (Rupees Fifty Three Lakh Thirty Four Thousand Sixty Seven and Paise Eighty Seven Only) as on 21.02.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 6<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 53,34,067.87/- (Rupees Fifty Three Lakh Thirty Four Thousand Sixty Seven and Paise Eighty Seven Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF MORTGAGE PROPERTY**  
All the piece and parcel of the property consisting of Row House No 24, Shubham Row House, Revenue Survey No. 38/1, Old Survey No. 46, T.P. Scheme No. 1, Final Plot No. 82 NALand Paikae, Piplod Road, Vesu Surat-395007.

Date : 06-July-2019  
Place : Surat  
Loan Account No: 2534793 & 2670907.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 02.03.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Nirajkumar V Dhaduk, 2. Manjulaben Niraj Dhaduk, to repay the amount mentioned in the notice being Rs. 59,25,231.59/- (Rupees Fifty Nine Lakhs Twenty Five Thousand Two Hundred Thirty One and Fifty Nine Paise Only) as on 02.03.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 6<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 59,25,231.59/- (Rupees Fifty Nine Lakhs Twenty Five Thousand Two Hundred Thirty One and Fifty Nine Paise Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES**  
All the piece and parcel of the property consisting of Office No. 1, 4th Floor, Shree Vinayak Arcade, "A" Type, Revenue Survey No. 186, Block No. 190 Paiki Southern Side Sub Plot No. 1, Town Planning Scheme No. 14 (MolaVarachha), Final Plot No. 50/A, Moje Mola Varachha, Surat, Gujarat - 395006.

Date : 06-July-2019  
Place : Surat  
Loan Account No: 2247449 & 2270885.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**APAR INDUSTRIES LIMITED**  
(CIN : L9110GJ1989PLC012802)  
Regd. Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodra - 390 007 (Gujarat), India.  
Phone : (0265) 233906 Fax : (0265) 233039  
E-mail : [com\\_sec@apar.com](mailto:com_sec@apar.com) Website : [www.apar.com](http://www.apar.com)

**NOTICE OF THE 30<sup>th</sup> ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION**

1. Notice is hereby given that the 30<sup>th</sup> (Thirtieth) Annual General Meeting (AGM) of the Shareholders of Apar Industries Limited (the "Company") will be held on Thursday, 8<sup>th</sup> August, 2019 at 2:15 p.m. at the Auditorium of the Vanijya Bhavan, Central Gujarat Chamber of Commerce, Race Course Circle, Vadodra - 390 007 (Gujarat). Notice of the meeting dated 29<sup>th</sup> May, 2019 setting out the businesses to be transacted there at together with the Audited financial statements for the financial year ended March 31, 2019, both on Standalone and Consolidated basis, Auditors' Report and Report of the Board of Directors for the year ended on that date and other relevant details have been sent to all the shareholders of the Company at their registered addresses and e-mailed to those shareholders whose e-mail addresses were registered with the Company. The company has completed dispatch of Annual Report on 8<sup>th</sup> July, 2019.

Please note that the Annual Report 2018 - 19 is also available on the Company's website at [www.apar.com](http://www.apar.com). Physical copies of the Annual Report shall be sent on request and also available for inspection at the Registered Office of the Company during 11:00 A.M. to 4:00 P.M. except Sundays and Holidays.

2. Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, 2<sup>nd</sup> August, 2019 to Thursday, 8<sup>th</sup> August, 2019, (both days inclusive) for the purpose of 30<sup>th</sup> AGM and to determine the names of the shareholders who shall be entitled to receive the dividend on Equity Shares for the Financial Year 2018 - 2019.

In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the following information is available to the Shareholders of the Company :

Members holding equity shares either in physical form or dematerialization form, as on the cut-off-date of 1<sup>st</sup> August, 2019, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of Central Depository Services (India) Limited (an Agency appointed for the purpose of providing e-voting facilities to the Shareholders of the Company) from a place other than venue of the AGM (remote e-voting). All the members are hereby informed that-

- The business as set forth in the Notice of the AGM dated 29<sup>th</sup> May, 2019 may be transacted through voting by electronic means;
- The remote e-voting shall commence on Sunday, 4<sup>th</sup> August, 2019 (10.00 Hrs. IST);
- The remote e-voting shall close on Wednesday, 7<sup>th</sup> August, 2019 (17.00 Hrs. IST);
- The cut-off-date for determining the eligibility to vote by electronic means or at AGM is Thursday, 1<sup>st</sup> August, 2019.
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off-date i.e. Thursday, 1<sup>st</sup> August, 2019, may obtain the login ID and password by sending a request at [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com). However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote;
- Members may note that:
  - The remote e-voting module shall be disabled by CDSL beyond 17:00 Hrs. IST on Wednesday, 7<sup>th</sup> August, 2019 and once the vote on a resolution is cast and confirmed by the member, the member shall not be allowed to change it subsequently;
  - The facility for voting through ballot / polling paper shall also be made available at the AGM. Ballot / Polling Paper for voting is also sent along with the Annual Report of the Company;
  - The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and
  - A person whose name is recorded in the Register of Members or in the Register of beneficial owners maintained by the depositories as on the cut-off-date i.e. Thursday, 1<sup>st</sup> August, 2019 shall be entitled to avail facility of remote e-voting as well as voting at the AGM through ballot / polling paper.

vii. The company has appointed Mr. Hemang M. Mehta, Proprietor of M/s. H. M. Mehta & Associates, Practising Company Secretary, Vadodra as the scrutineer to scrutinise the e-voting process in fair and transparent manner.

viii. The Notice of AGM and complete Annual Report 2018 - 19 is available on the Company's website at [www.apar.com](http://www.apar.com) and also on the CDSL's website at <https://www.evotingindia.com>

ix. In case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at <https://www.evotingindia.com>, under help section and for any grievances connected with E-voting facility may contact Mr. Rakesh Davi, Manager at CDSL, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013, Email: [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com) or call on toll free no. 1800225533.

By Order of the Board  
For Apar Industries Limited  
Sanjaya Kunder  
Company Secretary  
Place : Mumbai  
Date : July 09, 2019

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14.02.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Rajeshwari Prints, 2. Madanlal Satyanarayan Sharma, 3. Rajeshwari Madan Sharma, to repay the amount mentioned in the notice being Rs. 31,10,878.32/- (Rupees Thirty One Lakh Ten Thousand Eight Hundred Seventy Eight and Paise Thirty Two Only) as on 14.02.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 06<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 31,10,878.32/- (Rupees Thirty One Lakh Ten Thousand Eight Hundred Seventy Eight and Paise Thirty Two Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF MORTGAGE PROPERTY**  
All the piece and parcel of the property consisting of Flat No. 304, 3rd Floor Vinayak Residency, Aai Mata Road Dumbhal, Surat, Gujarat-395010.

Date : 06-July-2019  
Place : Surat  
Loan Account No: 2955085.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**IDFC FIRST Bank Limited**  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
CIN : L65110TN2014PLC097792  
Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

**APPENDIX IV [Rule 8(1)]**  
**POSSESSION NOTICE (For immovable property)**  
Whereas the undersigned being the authorised officer of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14.02.2019 calling upon the borrower, co-borrowers and guarantors 1. Rajeshwari Prints, 2. Madanlal Satyanarayan Sharma, 3. Rajeshwari Madan Sharma, to repay the amount mentioned in the notice being Rs. 31,10,878.32/- (Rupees Thirty One Lakh Ten Thousand Eight Hundred Seventy Eight and Paise Thirty Two Only) as on 14.02.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 06<sup>th</sup> day of July 2019.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 31,10,878.32/- (Rupees Thirty One Lakh Ten Thousand Eight Hundred Seventy Eight and Paise Thirty Two Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF MORTGAGE PROPERTY**  
All the piece and parcel of the property consisting of Flat No. 304, 3rd Floor Vinayak Residency, Aai Mata Road Dumbhal, Surat, Gujarat-395010.

Date : 06-July-2019  
Place : Surat  
Loan Account No: 2955085.

Sd/-  
Authorised Officer  
IDFC First Bank Limited  
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (The Act)**

S.NO	Name of Borrower(s) (A)	Particulars of Mortgage property/ (ies) (B)	Outstanding Amount (Rs.) (C)
1	LOAN ACCOUNT NO. HHLAE00343884  1.MR. PARESH S. SOLANKI ALIAS PARESH SHAMBHUBHAI SLOANKI 2.SOLANKI JAYSHRIBEN PARESHBHAI	FLAT NO. D-707, 7TH FLOOR, BLOCK-D, "PRATHAM HEIGHTS", REGISTRATION DISTRICT AND SUB-DISTRICT AHMEDABAD-11(ASLAL) TALUKASITUATED IN MOUJEVATVA, VATVA CANAL ROAD, NAROL-ASLALHIGHWAY, AHMEDABAD-382430, GUJARAT	Rs. 7,58,429/- (Rupees Seven Lakhs Fifty Eight Thousand Four Hundred Twenty Nine Only) as on 22.06.2019.
2	LOAN ACCOUNT NO. HLPASUR00321104  1. GONDALIYA JAGADISHBHAI K. ALIAS JAGADISHBHAI KANUBHAI GONDALIYA NALINI CHAUHAN 2. RINALBEN JAGDISHBHAI GONDALIYA	SHOP/ OFFICE NO. A-337, AVADH VICEROY, NEAR RISE ON PLAZA, OPPOSITE RAJHANS TOWER, SARTHANA, SURAT CITY (PRESENTLY PUNA), SURAT- 395006, GUJARAT	Rs. 27,68,361/- (Rupees Twenty Seven Lakh Sixty Eight Thousand Three Hundred Sixty One Only) as on 21.06.2019
3	LOAN ACCOUNT NO. HLPAME00353285  1. CHANDRESHBHAI PRVINBHAI PANCHAL ALIAS PANCHAL CHANDRESH 2. PANCHAL BHARTIBEN C ALIAS PANCHAL BHARTI	FLAT B- 1004, TENTH FLOOR, "RIDDIHWINAYAK TOWER" "VRAJ VIHAR (NARANPURA CO-OPERATIVE HOUSING SOCIETY LTD.)", MOUJE VADAJ VILLAGE TA. CITY AHMEDABAD-2(VADAJ), AHMEDABAD-380013, GUJARAT	Rs. 27,82,463/- (Rupees Twenty Seven Lakh Eighty Two Thousand Four Hundred Sixty Three Only) as on 26.06.2019
4	LOAN ACCOUNT NO. HLPAPHE00306520  1. RAJPUT JAMANAKUWAR 2. KISHORJING NAVALSING CHAUHAN ALIAS RAJPUT KISHORE SINGH PROPRIETOR KISHOR GARMENT	TENEMENT NO. 147, HARI GANGA CO. OP. HOUSING SOCIETY LIMITED, SURVEY NO. 505, 506, 507/2-3, NEAR MAHALAXMI SOCIETY, SONI NI CHAWL TO CMC MILL ROAD, MOUJE-ODHAV, AHMEDABAD-382415, GUJARAT	Rs. 29,87,620/- (Rupees Twenty Nine Lakhs Eighty Seven Thousand Six hundred Twenty Only) as on 24.06.2019
5	LOAN ACCOUNT NO. HHLBAR00389249  1. KUNAL NITIN RAVAL 2. VIVRANSHI NITINBHAI RAVAL 3. RAVAL PRITI NITIN	A-501, 5TH FLOOR, TOWER-A, SHREE KUNJ RESIDENCY, OPP. VOLTA MP TRANSFORMER, NEAR RAJPUT SAMAJ WADI, MAKARPURA ROAD, RS. NO. 509, JAMBUBVA, VADODARA - 390021, GUJARAT	Rs. 30,12,902/- (Rupees Thirty Lakhs Twelve Thousand Nine Hundred Two Only) as on 29.06.2019

That the above named borrower(s) have failed to maintain the financial discipline towards the loan account (s) and as per books of accounts maintained in the ordinary course of business by the Company, Column C indicates the outstanding amount. Due to persistent default in repayment of the Loan amount on the part of the Borrower(s) the above said loan account has been classified by the Company as Non Performing Asset within the guidelines relating to assets classification issued by Regulating Authority. Consequently, notices under Sec. 13(2) of the Act were also issued to each of the borrower.

In view of the above, the Company hereby calls upon the above named Borrower(s) to discharge in full his/her liabilities towards the Company by making payment of the entire outstanding dues indicated in Column C above including up to date interest, costs, and charges within 60 days from the date of publication of this notice, failing which, the Company shall be entitled to take possession of the Mortgage Property mentioned in Column B above and shall also take such other actions as is available to the Company in law.

Please note that in terms of provisions of sub-Section (8) of Section 13 of the SARFAESI Act, "A borrower can tender the entire amount of outstanding dues together with all costs, charges and expenses incurred by the Secured Creditor only till the date of publication of the notice for sale of the secured asset(s) by public auction, by inviting quotations, tender from public or by private treaty. Further it may also be noted that in case Borrower fails to redeem the secured asset within aforesaid legally prescribed time frame, Borrower may not be entitled to redeem the property."

In terms of provision of sub-Section (13) of Section 13 of the SARFAESI Act, you are hereby prohibited from transferring, either by way of sale, lease or otherwise (other than in the ordinary course of his business) any of the secured assets referred to in the notice, without prior written consent of Secured Creditor.

Sd/-  
Place: AHMEDABAD / SURAT / Vadodra (GUJARAT)  
For Indiabulls Housing Finance Ltd.  
Authorized Officer

**બરોડા ગુજરાત ગ્રામીણ બેંક**  
**BARODA GUJARAT GRAMIN BANK**  
(ભારત સરકાર, ગુજરાત સરકાર તથા બેંક ઓફ બરોડા દ્વારા પ્રાચોલિત)

**E-AUCTION SALE NOTICE**

The under mentioned properties which are in the physical possession of the Baroda Gujarat Gramin Bank (Erstwhile Dena Gujarat Gramin Bank) will be sold by - auction on 19.08.2019 strictly on "as is where is basis" and "as is what is" towards recovery of Bank's secured debt plus costs, charges and future interest thereon as per details given below. The auction will be online e-auctioning through website <https://sarfaesi.auctiontiger.net> on 19.08.2019 between 11:00 a.m. -01:00 p.m. (Property Also Available on Auction Tiger Mobile App)

Sr. No.	Name & Address of Borrower/ Mortgagee/Guarantors	Description of Secured Asset	Reserve Price Earnest Money Deposit (EMD)
1.	<b>Borrower:</b> M/s Bansidhar Cold Storage, At-Malgadh, Ta-Deesa, Dist- Banaskantha, Partners:- 1. Mali Kantibhai Chhogaji, At-Vadailfarn, Taluka-Deesa, District-Banaskatha, 2. Mali Prhladhji Chhogaji, At- Vadailfarn, Taluka-Deesa, District-Banaskatha, 3. Kachhava Sukhiben Chothaji, At-Malgadh, Taluka-Deesa, District-Banaskatha <b>Guarantors:</b> 1. Mali Shankarji Amraji, At-Lorvada, Taluka-Deesa, District-Banaskatha, 2. Mali Dahyaji Amraji, At- Ranpur, Aathamnavan, Taluka-Deesa, Dist-Banaskatha	All the part and parcel of the property consisting of N.A. Land of Cold Storage situated at R.S.No.19 paiki 1 paiki 1/paiki2, R.A/C.No.752 At- Malgadh, Taluka- Deesa, District-Banaskantha.	Rs. 4,91,08,929/- (Rupees Four crore Ninety One Lacs Eight Thousand Nine Hundred Twenty Nine Only)
2.	<b>Borrower:</b> M/s. Shree Sundha Cold Storage, At-Dama, Ta-Deesa, Dist-Banaskantha Partners:- 1. Jat Ujaji Valaji, At-Lakshimpura, Po-Varnoda, Ta- Deesa, Dist-Banaskantha, 2. Jat Bharatiji Ganeshaji, At-Lakshimpura, Po-Varnoda, Ta- Deesa, Dist-Banaskantha, 3. Jat Venaji Keshaji, At-Lakshimpura, Po-Varnoda, Ta- Deesa, Dist-Banaskantha, 3. Jat Kapuraji Iraji, At-Lakshimpura, Po-Varnoda, Ta- Deesa, Dist-Banaskantha, 6. Jat Kapuraji Ladhaji, At-Lakshimpura, Po-Varnoda, Ta- Deesa, Dist-Banaskantha, 7. Jat Umaji Nathaji, At-Rampura, Ta-Deesa, Dist.-Banaskatha. <b>Guarantors:</b> 1. Jat Bhuraji Ganeshaji, At-Lakshimpura, Po-Varnoda, Ta- Deesa, Dist-Banaskantha, 2. Ramkeshkumar Tanna, Somnath Township, Near Kachchhi Colony, Deesa, Ta. Deesa, Dist. Banaskantha, PIN-385535, 3. Ashabanu Salimkhan Baloch, At. 354/2, Sector No.3B, Gandhinagar, PIN: 382006, 5. Chhaganji Sonaji Sankhala, At. Goga Dhani, Po-Malgadh, Ta. Deesa, Dist. Banaskantha, PIN : 385535, 6. Gishikumar Ishwari adhyaji, At. Kuda vali Dhani, Po. Malgadh, Ta. Deesa, Dist. Banaskantha, PIN : 385505, 7. Kallashkumar Babulal Gelot, At & Po. Malgadh, Taluka : Deesa, Dist. Banaskantha, PIN : 385535, 8. Rajeshkumar Ganeshji Kachchhava, At. Nishavalli Dhani, Po. Malgadh, Taluka : Deesa, Dist. Banaskantha, PIN : 385535, 9. Ashaban Hiteshkumar Sundhesha, At. Nishavalli Dhani, Po. Malgadh, Taluka Deesa, Dist. Banaskantha, PIN: 385535, 10. Mukeshkumar Shankarlal Sankhala, At. Mama Dhani, Po. Malgadh, Taluka: Deesa, Dist. Banaskantha, PIN: 385535 <b>Guarantors:</b> 1. Haribhai Ganeshaji Gelot, B-31, Somnath Township, Opp. Havai Pillar, Deesa, Ta. Deesa, Dist. Banaskantha, PIN-385535, 2. Salimkhan Yashinhan Baloch, 354/2, Sector No. 3B, Gandhinagar, PIN : 382006,		

